

ઈજારદારશ્રીઓ માટે વિશેષ નોંધ

ઉપરોક્ત ટેન્ડરની આઈટમોના ભાવ ભરતી વખતે ઈજારદારશ્રીએ નીચેની બાબતોની ખાસ નોંધ લેવી.

- (૧) બાંધકામમાં વાપરવામાં આવનાર ઈટો ચિમની ભઠ્ઠાની તથા સ્પેશ્યલ કપચી, ગીટ, રેતી વિગેરે મટીરીયલ્સ સદર કામના ટેન્ડરના સ્પેશીફિકેશન પ્રમાણેનું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું લાવવાનું રહેશે. (સ્પેશ્યલ કક્ષા)
- (૨) લાકડાની આઈટમમાં ઉપયોગમાં લેવાનું લાકડું સ્પેશીફિકેશન પ્રમાણેનું ફક્ત સાગનું જ લાવવાનું રહેશે.
- (૩) બારી—બારણાની ફ્રેમ અને શટર માટે ઉપયોગમાં લેવામાં આવનાર એલ્યુમીનીયમ સેક્શન આઈટમના સ્પેશીફિકેશન પ્રમાણેની સાઈઝનું અને એકમ વજનનું હોવું જરૂરી છે. તેમજ જે તે એલ્યુમીનીયમ સેક્શન સક્ષમ કક્ષાની પાસે મંજૂર કરાવીને જ વાપરવાનું રહેશે.
- (૪) સેનેટરી મટીરીયલ્સ સ્પેશીફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણેની સાઈઝનું—ધોરણવાળા અને સક્ષમ કક્ષાએ મંજૂર કરેલ સેમ્પલ મુજબના જ લાવવાના રહેશે.
- (૫) બારી—દરવાજાના ફિક્ચર—કાસ્ટનીંગ સ્પેશીફિકેશન પ્રમાણેના ધારા—ધોરણવાળા અને સક્ષમ કક્ષાએ મંજૂર કરેલ સેમ્પલ મુજબના જ લાવવાના રહેશે.
- (૬) સદર કામમાં વાપરવામાં આવનાર ફ્લોરીંગ માટેની ટાઈલ્સ અને કોટા સ્ટોન સ્પેશીફિકેશન પ્રમાણેના જ જાડાઈના અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હોવા જોઈએ અને સેમ્પલ સક્ષમ કક્ષાએ મંજૂર કરાવ્યા મુજબનો જથ્થો લાવવાનો રહેશે.
- (૭) બાંધકામમાં વાપરવામાં આવનાર માલસામાન એન્જીનીયર ઈનચાર્જ ધ્વારા એપ્રુવડ સેમ્પલ મુજબનો વાપરવાનો રહેશે.
- (૮) સંપૂર્ણ કામની વર્કમેનશીપ લાઈન લેવલમાં હોવી જોઈએ તેમજ પોલીશીંગ અને ફિનિશીંગની કામગીરી ઉચ્ચ કક્ષાની કરવાની રહેશે.
- (૯) ટેન્ડર સાથે યંત્રો , ઓજારો તથા ચાલુ હાથ પરના કામોની વિગત ઈજારદારશ્રી ધ્વારા પુરી પાડવાની રહેશે.
- (૧૦) બિલ દર મહિને રજુ કરવા બાબત આગલા માસમાં કરી આપેલ બધા કામ માટે હવાલાના ઈજનેરે નક્કી કરેલ હોય તે તારીખ અથવા તે પહેલાં દર મહિને કોન્ટ્રાક્ટરે બિલ રજુ કરવાનું રહેશે. અને એ કામની ખરાઈ કરવાના ઉદ્દેશ્યથી હવાલાના ઈજનેર જરૂરી માપ લેશે. અથવા લેવડાવશે. અને બિલ રજુ થયા બાદ ગ્રાન્ટ અથવા એન.ઓ.સી. ઉપલબ્ધ થયે તેનું ચુકવણું કરવામાં આવશે. કામ થયા બાદ તેના બિલનું ચુકવણું વિલંબથી થાય તો તે અંગે કોઈ વ્યાજ ચુકવવા પાત્ર બનશે નહીં. ઉપર જણાવ્યા મુજબના નિયત સમયની અંદર કોન્ટ્રાક્ટર બિલ રજુ નહીં કરે તો હવાલાના ઈજનેરે પોતાના તાબાના કોઈપણ અધિકારીને કોન્ટ્રાક્ટરે અધિકૃત કરેલ એજન્સીની હાજરીમાં ઉક્ત કામનું માપ લેવા મોકલશે અને તેવી માપયાદી પરની કોન્ટ્રાક્ટરની કે તેના એજન્ટની સહી, તેના અનુમોદન માટે પુરતી ગણાશે, અને હવાલાના ઈજનેર આવી યાદીમાંથી બીલ બનાવશે, જે કોન્ટ્રાક્ટરને બધી બાબતમાં બંધનકર્તા રહેશે.

ટેકેદારની સહી

કાર્યપાલક ઈજનેર
પાટનગર યોજના વિભાગ નં.૨
ગાંધીનગર.

INSTRUCTION OF PERSON TENDERING

WATER SUPPLY

For all purpose connected with the work, the contractor is required to make his own arrangement for sufficient supply of water in such quantity and of such quality and at such places on the work as may be necessary. The rates quoted in the tender are for completed items of works and shall cover cost of water as aforesaid.

The Department may supply the water to the contractor, if so requested to him and if available near by department source. However, if his request is accepted, the department will in now may be found to continue supply, if arranged, till completion of work and it may be discontinued at any time after giving twenty four hours notice.

If the water is supplied by the Department the charge will be levied at Rs.5 per Rs.1000 of the cost of work done. The amount of water charges will be deducted by the Department.

The department will give one water supply connections free of cost from the main line or place as it is convenient to the department. The contractor shall have to make his own arrangement for laying the required pipe line from the connection, the same will be given if possible, on payment of necessary charges for the additional connection, as may be decided by the Department.

Dated Signature
Of the contractor

Executive Engineer,
Capital Project Division No.2,
Gandhinagar.

કોન્ટ્રાક્ટરો ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ નં. ટીએનસી-૧૦૮૮-આઈબી-૨૨૦-(૧૮)-સ, તા. ૧૭-૧૨-૮૮ પ્રમાણેની શરતોએ ખુલ્લા બજારમાંથી સીમેન્ટ તથા લોખંડ આ કામે ખરીદવાના રહેશે.

- (૧) ઠેકેદારોએ આઈ.એસ. પ્રમાણપત્રવાળો તથા મુળ મુખ્ય ઉત્પાદક કંપનીમાંથી સીધી રીતે સીમેન્ટ મેળવવાનો રહેશે. તેથી ખરાઈ માટે તેના ચુકવણીના બીલો સંબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને રજુ કરવાના રહેશે અને સીમેન્ટ સ્થળ (સ્ટોર) ઉપર લાવ્યા બાદ ખાતા તરફથી જરૂરીયાત પ્રમાણે ટેસ્ટ કર્યા બાદ યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવી કામમાં વાપરવાનો રહેશે. જો સીમેન્ટ યોગ્યતા પ્રમાણે નહીં હોયતો ઠેકેદારને સીમેન્ટ તાત્કાલિક સ્થળ પરથી પોતાના ખર્ચે દુર કરવાનો રહેશે.
- (૨) લોખંડની ખરીદી સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અથવા અન્ય મુળ ઉત્પાદક કંપનીઓ પાસેથી જ ઠેકેદારો કરે અને તેના ચુકવણીના વાઉચરોપણ ખરાઈ માટે રજુ કરે તે કાર્યપાલક ઈજનેરશ્રી જોવાનું રહેશે. તેમજ લોખંડ યોગ્ય ગુણવત્તાવાળું છે કે નહીં તેની ખરાઈ ખાતા મારફતે થઈ ગયા બાદ જ ઉપયોગમાં લેવાનું રહેશે અને તેના ટેસ્ટ રીપોર્ટ પણ ઈજારદારે રજુ કરવાનો રહેશે. જે લોખંડનો જથ્થો ટેસ્ટ કરાવ્યા બાદ કામમાં વાપરવા લાયક ગણાશે નહીં. તે જથ્થો ઠેકેદારે પોતાના ખર્ચે કામની સાઈટ ઉપરથી ઉપાડી જવાનો રહેશે.

ઠેકેદારની સહી

કાર્યપાલક ઈજનેર
પાટનગર યોજના વિભાગ નં. ૨
ગાંધીનગર.

ખાણ અને ઉર્જા વિભાગ
નંબર: એમસીઆર-૨૧૮૮(૮)(૧૫)-હ, તા. ૨૫-૧-૮૧.

આ ઠરાવ તા. ૧-૩-૮૧ થી અમલમાં આવશે.

રાજ્ય સરકાર પંચાયતના સરદાર સરોવર નર્મદા નિગમના બાંધવામાં આવતા રસ્તાઓના કે સિંચાઈ વગેરેના કામો માટે સાદી માટી(ઓડીનરી કલે અર્થ)અને (સોફ્ટ)મુરમ વાપરવામાં આવે છે ત્યારે ગુ.ખો.ખા.ની ૧૯૬૬ મુજબ રોયલ્ટી થશે નહીં.(સોફ્ટ)મુરમ સિવાય ખનીજ હાર્ડ મુરમ કે બ્લેક ટેપ સાથે હરોળમાં ગણાય છે, તેને આ મુકિતનો લાભ મળશે નહીં. સ્થાનિક યુસ્ત અભિપ્રાય સંબંધમાં મળતો હોયતો નિયામકશ્રી, ભુસ્તક વિજ્ઞાન અને ખનીજ અમદાવાદનો અભિપ્રાય લેવાનો રહેશે.

માટી અને સોફ્ટ મુરમ માટેના રોયલ્ટી આ લાભ સરદાર સરાવેર નર્મદા નિગમ સિવાયના અન્ય બોર્ડ કોર્પોરેશનને નહીં.

માટી અને સોફ્ટ મુરમને આ રીતે મુકિતનો લાભ આપવામાં આવ્યો છે તે અંગેની જાણ માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ વિકાસ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ તથા પંચાયતના કામો રાખનારાઓએ થવી જોઈએ. જેથી રોયલ્ટી મુકિત કે કોન્ટ્રાક્ટરને મળે છે તેને કારણે તેમના પ્રમાણમાં ઓછા ભાવે ટેન્ડરો મળે અને સરકારને /પંચાયતોને /સરદાર સરોવર નર્મદા નિગમ વિગેરેને મુકિતના અંતિમ લાભ મળી શકે. આ કામો માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ વિકાસ વિભાગ અને વિભાગે જરૂરી કાર્યવાહી કરી ઉદ્યોગ, ખાણ , ઉર્જા વિભાગને જાણ કરવાની રહેશે.

માટી અને સોફ્ટ મુરમ સિવાયના અન્ય ગોણ બાબતના ઉ.ખા ખનીજ ૧૯૬૬ અને તેના અનુસંધાનના વખતો વખતના બહાર પાડેલા ઠરાવો લાગુ પડશે અને તે મુજબ લીઝ કે પરમીટ લેવાનું અને રોયલ્ટી ભરવાની રહેશે.

ઠેકેદારની સહી

કાર્યપાલક ઈજનેર
પાટનગર યોજના વિભાગ નં.૨
ગાંધીનગર.

ખાસ શરત

પાટનગર યોજના વર્તુળ હસ્તકના કામો માટે સરકારશ્રી દ્વારા નિમવામાં આવેલ કન્સલ્ટન્ટ / સ્થપતિ / કા.ઈ.શ્રી / ના.કા.ઈ.શ્રી દ્વારા આ કામોમાં સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવશે અને આ નિરીક્ષણ દ્વારા સુચવવામાં આવેલ સુચનો જેવા કે માલસામાનની ગુણવત્તા, કામની ગુણવત્તા, લાઈન લેવલ, વર્કમેનશીપ વગેરે ઈજારદારને બંધનકર્તા રહેશે, અને ઈજારદારે તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

- (૧) આ કામના કલરકામ માટે જરૂરી " કલર " નો જથ્થો લાવતા પહેલા ઈજારદારે હાલ ઉપલબ્ધ બજારમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કલર પૈકીમાંથી એક કંપનીનો કલર કાર્યપાલક ઈજનેર પાસે એપ્રુવ કરાવવાનો રહેશે. કલર ઈજારદારશ્રીએ લાવવાનો રહેશે. ઈજારદારશ્રીએ કલર કામની આઈટમ માટે જે કલરનો કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા એપ્રુવ કંપનીનો જથ્થો લાવી સંલગ્ન સેક્શન ઓફિસરને જમા કરાવવાનો રહેશે. આ જથ્થો કલર કામની આઈટમની કામગીરી માટે જરૂરીયાત મુજબ ઈજારદારને ઈસ્યુ કરી કામ કરાવવાનું રહેશે. આ અંગે આવક જાવકનું રજીસ્ટર વર્ક આસીસ્ટન્ટ દ્વારા નિભાવવાનું રહેશે.
- (૨) કાર્યપાલક ઈજનેર દ્વારા એપ્રુવ કરેલ કંપનીના કલર ઈજારદારે આ કામમાં જરૂરી કલરના જથ્થાના ઓછામાં ઓછા ૫૦ ટકા સાઈટ પર લાવીને સેક્શન અધિકારીને જમા કરાવવાનો રહેશે.
- (૩) આ કામના કલરની આઈટમની કામગીરી માટે ઈજારદારે જમા કરાવેલ કલરનો જથ્થો આવક જાવકના રજીસ્ટરમાં લઈ કામમાં જરૂરીયાત મુજબ જ કામના હવાલાના વર્ક આસીસ્ટન્ટ / સેક્શન ઓફિસર દ્વારા ઈજારદારના કામ માટે ઈસ્યુ કરવાનો રહે અને આ જ કલર દ્વારા કલર કામ હાથ ધરવાનું રહેશે.

ઉપર મુજબની પદ્ધતિ હાલ સિમેન્ટ વપરાશમાં અનુસારવામાં આવતી પદ્ધતિ મુજબ અનુસરવાની રહેશે.

કોન્ટ્રાક્ટરની સહી

કાર્યપાલક ઈજનેર,
પાટનગર યોજના વિભાગ નં. ૨,
ગાંધીનગર.

રસ્તા, પુલો તથા મકાન બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશન અંગેના કામના સ્થળ ઉપર બોર્ડ મુકવા બાબત.

ગુજરાત સરકાર,
જાહેર બાંધકામ વિભાગ,
પરિપત્ર નં. બીડીજી-૩૨૭૭(૧૬૫૭)-ન,
સચિવાલય, ગાંધીનગર.
તા.૨૬-૪-૧૯૭૮

પ રિ પ ત્ર :

જાહેર બાંધકામ વિભાગ મારફત થતાં રસ્તા, પુલો તથા મકાનોના બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશનની માહિતી જાહેર જનતાને જે તે કામના સ્થળ ઉપર જાણ માટે મળી શકે તથા જાહેર જનતા તે અંગે યોગ્ય સુચનો કરી શકે તેમાટે કામના સ્થળ ઉપર સરળ ભાષામાં બોર્ડ મુકવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણામાં હતી, સરકારે આ અંગે યોગ્ય વિચારણા કરી દરાવેલ છે કે આ વિભાગ તરફથી કરવામાં આવતા રસ્તા, પુલો તથા મકાનોના કામો માટેની નીચે જણાવ્યા મુજબની વિગતો દર્શાવતા બોર્ડ કામના સ્થળ ઉપર જાહેર જનતાની જાણ માટે મુકવા.

જાહેર વિજ્ઞાપ્તી

આ રસ્તા, પુલોનું તથા મકાનોનું કામ ગુજરાત રાજ્યના જાહેર બાંધકામ વિભાગ હેઠળના વિભાગ હેઠળ પેટા-વિભાગ હસ્તક ચાલે છે.

આ કામના સામાન્ય સ્પેશીફિકેશન નીચે પ્રમાણે છે.

(૧) રસ્તા અંગેના સ્પેશીફિકેશન :

૧. ઓવરસાઈઝ મેટલનું.....સે.મી. દબાવેલ જાડો દર.
૨. મેટલ.....સે.મી. દબાવેલ જાડો દર.
૩. પેઢીનું નામ
૪. ડામરની સપાટી પોણા ઈંચની જાડી કારપેટ ૧૦સે.મી.માં..... કપચી..... શ્રીટ..... આસ્ફાલ્ટ વાપરીને કરવાની છે.

(૨) પુલનું કામ :

૧. પુલના..... ગાળા દરેક..... મીટર લંબાઈની.
૨. પીયર કેપનું કોન્ક્રીટ ૧:૨:૪ ના પ્રમાણમાં,
૩. સ્લેબનું કોન્ક્રીટ ૧:૨:૪ હાઈએડ કવોલીટી કન્ટ્રોલ ૧૫૦/૨૦૦ એમ.એમ.
૪. પુલના પાયાનો કોન્ક્રીટ ૧:૩:૬ ના પ્રમાણમાં થાંભલા એને એબટમેન્ટનું કોન્ક્રીટ ૧:૩:૬ ના પ્રમાણમાં.

(૩) મકાનો :

૧. પાયાનું કોન્ક્રીટ પથ્થરનું ૧:૩:૬ નું પ્રમાણ.
૨. ઈંટોનું ચણતર અને ૧ અને ૬ નું પ્રમાણ.
૩. ભોયતળીયું ૧:૨:૩ નું ચુનાનું કોન્ક્રીટ કે ૧:૪:૮ સીમેન્ટનો કોન્ક્રીટ ઉપર ૧ ઈંચ સાઈઝની મોઝેક ટાઈલ્સ.
૪. બારી-બારણા સાગી લાકડાના.
૫. આર.સી.સી. કામ ૧:૨:૪ કે ૧૫૦ એમ.કે. ૨૦૦ એમ.નું

આ કામની વિગતે સ્પેશીફિકેશન નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી..... પેટા-વિભાગની કચેરીએ ઓફીસના સમય દરમિયાન કોઈપણ સમયે જોઈ શકાશે.

તો માહિતી માટે તે અધિકારીનો સંપર્ક સાધવો.

આ કામની માલીક જાહેર જનતાની છે અને કામમાં કોઈ ક્ષતિ કે અનિયમિતતા જણાય તો તે બાબતમાં જાહેર બાંધકામ વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી..... જેઓની કચેરી..... સ્થળ છે. તેમનું ધ્યાન દોરવા વિનંતી છે.

ઠેકેદારની સહી

કાર્યપાલક ઈજનેર
પાટનગર યોજના વિભાગ નં.૨
ગાંધીનગર.

માર્ગ અને મકાન વિભાગ
ક્રમાંક - ટી.એન.સી-૨૨૮/પુ.ઓ. ૩૯(૧૯) સ
૧૪, સરદારભવન, સચિવાલય, ગાંધીનગર.
તારીખ:- ૨૩-૧૦-૮૯

પ રિ પ ત્ર :

વિષય : રાજ્ય સરકારનાં બાંધકામ માટે વપરાતા ખનિજોની રોયલ્ટી ભરવા બાબત.

સંદર્ભ : સરકારશ્રીના તારીખ: ૨૫-૨-૮૭ના પત્ર.

ક્રમાંક : ટી.એ.સી.- ૨૨૮૬/પુ.ઓ. ૧૯ (૧૯/સ)

ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગના ઉપરોક્ત વિષય અને પરત્વેના તા. ૧-૧-૮૭ના ઠરાવ ક્રમાંક: એમ.સી.આર.-૨૧૬૮/છ ની નકલ તેમાં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવાની સૂચના સાથે આ વિભાગના સંદર્ભ હેઠળના પત્રથી સર્વ અધિકારીઓને મોકલવામાં આવેલ છે. તારીખ: ૧-૧-૮૭ના રોજ સચિવશ્રી, ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગની ચેમ્બરમાં મીટીંગ યોજવામાં આવેલ જેમાં કોન્ટ્રાક્ટરોના હાજર રહેલ પ્રતિનિધિઓને સાંભળીને ચર્ચા વિચારણાને અંતે નીચે મુજબ નિર્ણય કરવામાં આવેલ છે.

(૧) રૂા. ૨.૦૦ લાખ (બે લાખ) થી વધુ અંદાજી રકમના કામો હોય તેવા કામો માટે કાર્યપાલક ઈજનેરશ્રી કામનો વર્ક ઓર્ડર આપે કે તુરતજ તે કામના શીડયુલ બી ની નકલ જે તે વિસ્તારના મદદનીશ નિયામક અથવા જીઓલોજીસ્ટ અથવા આસીસ્ટન્ટ જીઓલોજીસ્ટ અથવા ભુસ્તર અને ખનીજ શાખાના જીલ્લા કચેરીના વડા જેઓ કલેક્ટરશ્રીની કચેરીમાં બેસે છે. તેમને આપવાની રહેશે.

(૨) રૂા. ૨.૦૦ લાખ (બે લાખ) થી ઉપરના કામના કોન્ટ્રાક્ટરોએ તેઓએ ખરીદેલ ખનીજના જથ્થા અને તે ક્યાંથી ખરીદે છે? તે વેચનારની વિગતો દર્શાવતા બીલોની નકલો તથા પત્રકના રૂપમાં દર ત્રણ માસ ઉપર (૧) માં દર્શાવેલ અધિકારીને પુરી પાડવાની રહેશે. આ બીલમાં વેચનારનું નામ, સ્થળ, તારીખ અને માલ લેનારનું નામ અને જથ્થા વગેરે દર્શાવેલા હોવા જોઈએ.

(૩) જરૂર પડયે જરૂરી કીસ્સામાં ઉપર

(૧) માં દર્શાવેલ અધિકારીશ્રી તરફથી વધુ માહિતી વિગત માલ કે બીલના સંબંધમાં માંગવામાં આવે તો જે તે કાર્યપાલક ઈજનેરશ્રી, ખનીજ ખાતાના અધિકારીને તે કોન્ટ્રાક્ટર પાસેથી માંગવામાં મદદ કરશે. જો આવી માહિતી સમયસર આપવામાં ન આવે કે કોઈ કાર્યપાલક ઈજનેરશ્રી, તરફથી આ અંગે સહકાર ન મળે તો ખનિજ વિભાગના અધિકારી આ બાબત નિયામકશ્રીના ધ્યાન પર મુકશે. જેઓ આ અંગે ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગ તથા જે તે સંબંધિત વિભાગના સચિવશ્રીના ધ્યાન પર મુકશે, અને આવા પત્ર મળ્યેથી સંબંધિત વિભાગના સચિવશ્રી, જે તે કાર્યપાલક ઈજનેરશ્રીને તાત્કાલિક માહિતી પુરી પાડવા સૂચના આપશે.

(૨) આ પ્રથા અમલી બનતા આ પરીપત્રની તારીખથી સીક્યોરીટી ડીપોઝીટ પરત કરવા માટે રોયલ્ટી ભર્યા અંગેના પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.

(૩) આ પરીપત્રની તારીખથી આ પ્રથા અમલી બનાવવામાં આવે છે. તે પહેલા કોન્ટ્રાક્ટરે જે માલ વાપર્યા હોય તેના સંબંધમાં "નો ડયુ સર્ટીફિકેટ" તે વખતની પ્રજા મુજબ મેળવવાનું રહેશે.

(૪) માર્ગ અને મકાન વિભાગ કે અન્ય વિભાગ હસ્તકની કામગીરી સરકારી કચેરીઓમાંથી કોન્ટ્રાક્ટરે ઉપાડેલ/ વાપરેલ ખનીજ રોયલ્ટી કોન્ટ્રાક્ટર ભરપાઈ કરી આપે તે જોવાની જવાબદારી જે તે વિભાગની રહેશે.

(૫) હવે પછી ઉપર પ્રમાણે કાર્યવાહી કરવા આથી સર્વેને સૂચના આપવામાં આવે છે.

રસ્તા, પુલો તથા મકાન બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશન અંગેના કામના સ્થળ ઉપર બોર્ડ મુકવા બાબત.

ગુજરાત સરકાર,
માર્ગ અને મકાન વિભાગ
ઠરાવ ક્રમાંક:ટીએનસી-૧૦૮૦-૨૪-સ,
સચિવાલય, ગાંધીનગર.
તા.૨૭-૧૧-૧૯૮૦

સંદર્ભ : જા.બાં.વિ.ના પરિપત્ર ક્રમાંક:બીસીજી-૩૨૭૭-(૧૫૬) તા.૨૬-૪-૧૯૭૮.

ઠ રા વ :

રસ્તા, પુલો તથા મકાનોના બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશન અંગેના કામના સ્થળ ઉપર બોર્ડ મુકવા અંગે સંદર્ભમાં દર્શાવેલ પરિપત્રથી જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. આવા કામની વિગત દર્શાવતાં બોર્ડ મુકવા અંગેનો ખર્ચ વિભાગ તરફથી કરવામાં આવતો હતો. કામ પુર્ણ થયા બાદ બોર્ડ બિન જરૂરી પડી રહેતા હતા. આવો ખર્ચ નિવારવાની બાબત સરકારશ્રી વિચારણામાં હતી. પુર્ણ વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે કે જ્યારે આવુંબોર્ડ કામ રાખનાર ઠેકેદારે તેમના ખર્ચે મુકવાનું રહેશે. કામ ચાલુ કરવાનો હુકમ આપવામાં આવે તે પહેલા આ બાબતની જરૂરી સંમતિઓ ઈજારદાર પાસેથી લેખિતમાં લેવી તેમજ કોન્ટ્રાક્ટ દ્વારા આવું બોર્ડ મુકવામાં આવે તેઅંગે પુરતી કાળજી રાખવી.

આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર નાણાંકીય સલાહકારશ્રીની તા. ૧૫-૨-૮૧ ની નોંધથી મળેલ સંમતિથી બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(પ્ર.ર.ચોકસી)
ખાસ ફરજ પરના અધિકારી
માર્ગ અને મકાન વિભાગ

પ્રતિ,

- રાજ્યપાલશ્રીના સચિવશ્રી, ગાંધીનગર.
- મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- બધા મંત્રીશ્રીઓના અંગત સચિવ, ગાંધીનગર સચિવાલય બધા વિભાગો.
- એકાઉન્ટન્ટ જનરલશ્રી, ગુજરાત અમદાવાદ બધા ખાતાના વડાઓ, બધી કચેરીના વડાઓ.
- સર્વે અધિક્ષક ઈજનેરશ્રી(મા.મ.)વર્તુળ/વર્તુળ/પંચાયત/ .ધો.મા.વર્તુળ/ એ.વે.વર્તુળ/ વિદ્યુત વર્તુળ સહિત
- સર્વે કાર્યપાલક ઈજનેરશ્રીઓ, ઉપરોક્ત વર્તુળ હેઠળના સર્વે વિભાગો.

રસ્તા, પુલો તથા મકાન બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશન અંગેના કામના સ્થળ ઉપર બોર્ડ મુકવા બાબત.

ગુજરાત સરકાર,
માર્ગ અને મકાન વિભાગ
ઠરાવ ક્રમાંક:ટીએનસી-૧૦૮૦-૨૪-સ,
સચિવાલય, ગાંધીનગર.
તા. ૧૮-૧૧-૧૯૮૧

સંદર્ભ : સરકારશ્રી સરખા ક્રમાંકનો તા. ૨૭-૧૧-૮૦ નો ઠરાવ.
આમુખ : રસ્તા, પુલો તથા મકાનના બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશન અંગેના કામના સ્થળ ઉપર બોર્ડ મુકવા બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ છે.

ઠ રા વ :

પુખ્ત વિચારણાને અંતે આથી ઠરાવવામાં આવે છે કે રસ્તા, પુલો તથા મકાનોના કામનો વર્ક ઓર્ડર મળ્યા પછી તુરત જ કામના સ્થળે કરવાના કામના સ્પેશીફિકેશન અંગેનું બોર્ડ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે મુકવાનું રહેશે.

ઉપરોક્ત શરત ટેન્ડરમાં ભાગ તરીકે ગણવાની રહેશે અને ટેન્ડરમાં તેનો સમાવેશ કરવાનો રહેશે.

આ હુકમોનો અમલ હુકમો રવાના થયાની તારીખથી કરવાનો રહેશે.

આ હુકમો આ વિભાગના સરખા ક્રમાંકની ફાઈલ પર નાણાં સલાહકારશ્રીની તા. ૧૧-૮-૮૧ ના સંમતિથી બહાર પાડવામાં આવેલ છે.

આ હુકમો માર્ગ અને મકાન વિભાગના બધાજ કામોને લાગુ પડશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સહી/-
એ.જી.દોશી
નાયબ સચિવ
માર્ગ અને મકાન વિભાગ

બાંધકામ કોન્ટ્રાક્ટર માટે સિક્યોરીટી ડીપોઝીટ સ્વીકારવાની પ્રથામાં અંશતઃ ફેરફાર કરવા બાબત.

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ
સચિવાલય, ગાંધીનગર
તા. ૩૧-૮-૧૯૮૪

વંચાણે લીધા : સરકારશ્રીનો સરખો ક્રમાંક ઠરાવ તા. ૪-૫-૮૩

આ મુ ખ :

કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતાં કામો માટે સિક્યોરીટી ડીપોઝીટની પ્રથમ ૫૦% રકમ નાની બચત સ્વરૂપે અથવા સરદાર સરોવર નર્મદા નિગમની બાંધી મુદતની થાપણ (ડીપોઝીટ)ના સ્વરૂપમાં ઈજારદારોએ કામનાં કરાર કરતા પહેલાં જમા કરવાની રહેશે અને આ ડીપોઝીટની મુદત ઓછામાં ઓછી બે વર્ષની રહેશે. તેમ ઉપર જણાવેલ સરકારશ્રીના સરખા ક્રમાંકના ઠરાવ તા. ૪-૫-૮૮માં ઠરાવવામાં આવેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ સરકારશ્રીના આ ડીપોઝીટની મુદત જે હાલ બે વર્ષની છે તે એક વર્ષની કરવા માટેની થયેલ રજુઆતનાં આધારે ૪-૫-૮૩ ના ઠરાવમાં અંશતઃ ફેરફાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠ રા વ :

પુખ્ત વિચારણાને અંતે સરકારના બાંધકામોના કોન્ટ્રાક્ટ માટે સીક્યોરીટી ડીપોઝીટ સ્વીકારવાની પ્રવર્તમાન તા. ૪-૫-૮૩ના સરખા ક્રમાંકના ઠરાવ મુજબની પ્રથા નીચે મુજબ ફેરફાર કરવા અંગેનું ઠરાવે છે.

- (૧) સીક્યોરીટી ડીપોઝીટની પ્રથમ ૫૦ ટકા રકમની નાની બચતના સ્વરૂપે અથવા સરદાર સરોવર નર્મદા નિગમની બાંધી મુદતની થાપણ (ડીપોઝીટ) ની મુદત ઓછામાં ઓછી એક વર્ષની રહેશે.
- (૨) સીક્યુરીટી ડીપોઝીટની બાકીની ૫૦% રકમ ઈજારદારના બીલમાંથી વસુલ લેવાની પ્રવર્તમાન પ્રથા ચાલુ રહેશે. આ રકમ સામે કેટલાક ઈજારદારો બેન્ક ગેરંટી રજુ કરે છે. આ રકમ પણ નો ઈજારદાર સંમતિ આપે તો સરદાર સરોવર નર્મદા નિગમની બાંધી મુદતની થાપણ (ડીપોઝીટ) અથવા નાની બચત સ્વરૂપે ફેરવવામાં આવશે.

આ હુકમનો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પરની નાણાં વિભાગની તા. ૨૧-૭-૮૪નાં રોજની નોંધથી મળેલ સંમતિથી બહાર પાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યપાલશ્રીનાં નામે અને તેમનાં હુકમથી,

સહી/-
પ્રા.લી. પારેખ
નાયબ સચિવ
માર્ગ અને મકાન વિભાગ

વિષય : રસ્તા, પુલો તથા મકાનોના બાંધકામની વિગતો તથા સ્પેશીફિકેશન અંગેના કામના સ્થળ ઉપર મુકવા બાબત.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ
પરિપત્ર ક્રમાંક: ટીએનસી-૧૦૮૦-૨૪-સ
સચિવાલય, ગાંધીનગર
તારીખ: ૨૭-૮-૨૦૦૨

- સંદર્ભ :**
- (૧) જાહેર બાંધકામ વિભાગનો પરિપત્ર ક્રમાંક: બીડીજી-૩૨૭૭-(૧૬૫)-ન તા.૨૬-૪-૭૮
 - (૨) માર્ગ અને મકાન વિભાગનો ઠરાવ ક્રમાંક: ટીએનસી-૧૦૮૦-૨૪-સ
 - (૩) માર્ગ અને મકાન વિભાગનો ઠરાવ ક્રમાંક: ટીએનસી-૧૦૮૦-૨૪-સ તા.૧૮-૧૧-૮૧
 - (૪) માર્ગ અને મકાન વિભાગનો ઠરાવ ક્રમાંક: ટીએનસી-૧૦૮૭-સ તા.૨૨-૭-૮૮

પ રિ પ ત્ર :

માર્ગ અને મકાન વિભાગના સંદર્ભ હેઠળના પરિપત્રથી રસ્તા, પુલ અને મકાનોના કામોના વર્કઓર્ડર આપ્યા બાદ તુર્તજ કામના સ્થળે કામની વિગત તથા સ્પેશીફિકેશન દર્શાવતું બોર્ડ ઈજારદારશ્રીની સ્વખર્ચે મુકવાની સુચના આપવામાં આવે છે. તા.૧૮-૧૧-૮૧ ના ઠરાવ અનુસાર આ બોર્ડ મુકવાની શરત ટેન્ડરના ભાગ તરીકે ગણવા પણ ઠરાવવામાં આવેલ છે.

આમ છતાં સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે કે, ઉપરોક્ત સુચનાઓનું ચુસ્તપણે અમલ કરવામાં આવતો નથી. જે યોગ્ય ન હોઈ આથી આપના કાર્યક્ષેત્રના રૂ.૫૦ લાખ વધારે અંદાજી કિંમતના કામો ઉપર સંદર્ભિત સુચનાઓનો ચુસ્તપણે અમલ થાય તેની દરેક અધિક્ષક ઈજનેરશ્રી / કાર્યપાલક ઈજનેરશ્રી / નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીને સુચના આપવામાં આવે છે.

કામની વિગતનો નમુનો આ સાથેના પરિશિષ્ટમાં દર્શાવેલ છે.

ઉપરોક્ત સુચનાઓનો અમલ ચુસ્તપણે થાય તેની કાળજી રાખવાની રહેશે.

સહી/-
(ચ.મ.ભટ્ટ)
ઉપસચિવ
માર્ગ અને મકાન વિભાગ.

બિડાણ : પરિશિષ્ટ

પ્રતિ,

સર્વે અધિક્ષક ઈજનેરશ્રીઓ, માર્ગ અને મકાન વર્તુળ / પંચાયત (મા.મ) વર્તુળ, નેશનલ હાઈવે વર્તુળ / રા.મા.યો.વર્તુળ / એક્સપ્રેસ પેટા વર્તુળ / પાટનગર યોજના વર્તુળ અને વિદ્યુત મા.મ.વર્તુળ સી'ત્ડી
સર્વે કાર્યપાલક ઈજનેરશ્રીઓ, ઉપરોક્ત વર્તુળો હસ્તકના સર્વે વિભાગો.
પ્રોજેક્ટ શાખાઓ, મા.મ.વિભાગ, સચિવાલય, ગાંધીનગર
સીલેક્ટ ફાઈલ-૨૦૦૨

રાજ્ય સરકારના બાંધકામ માટે વપરાતા ગૌણ ખનિજની રોયલ્ટી ભરવા બાબત.

ગુજરાત સરકાર
ઉદ્યોગ અને ખાણ વિભાગ,
ઠરાવ ક્રમાંક: એમએમઆર/૧૧૨૦૦/૨૦૧૩/છ
સચિવાલય, ગાંધીનગર
તારીખ: ૧-૮-૨૦૦૪

વંચાણે લીધા:

- (૧) ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગનો ઠરાવ ક્રમાંક: એમસીઆર-૨૧૬૮-૭૩૮૦-છ, તા. ૧૨-૧૨-૧૯૬૮
- (૨) ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગનો ઠરાવ ક્રમાંક: એમસીઆર-૨૧૬૮-૮-૬૬૮૫-છ, તા. ૧-૧-૧૯૮૭
- (૩) ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગનો ઠરાવ ક્રમાંક: એમસીઆર-૨૧૮૮-(૮)-૬૫-છ, તા. ૨૫-૧-૧૯૮૧
- (૪) ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગનો ઠરાવ ક્રમાંક: એમસીઆર-૧૦૮૭-૨૮૫૬-છ, તા. ૬-૧૧-૧૯૮૭
- (૫) માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ એમ્પાવર્ડ કમીટીની તા. ૧૮-૬-૨૦૦૪ ની બેઠકની કાર્યવાહીની નોંધ.

ઠરાવ :

ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગના સંદર્ભ - (૩) હેઠળના ઠરાવની એવી જોગવાઈ કરવામાં આવેલ કે, રાજ્ય સરકારના, પંચાયતોના અને સરદાર સરોવર નર્મદા નિગમના બાંધવમાં આવતાં રસ્તાઓનાં કે સિંચાઈ વગેરેના કામો માટે જ્યારે સાદી માટી (ઓર્ડીનરી ક્લે અર્થ) અને (સોફ્ટ) મુરમ વાપરવામાં આવે ત્યારે ગુજરાત ગૌણ ખનિજ નિયમ, ૧૯૬૬ મુજબ રોયલ્ટી લેવાના નિયમો લાગુ પડશે નહીં. એટલે કે આ કામો માટે કોન્ટ્રાક્ટરો પાસે સાદી માટી (ઓર્ડીનરી ક્લે-અર્થ) અને (સોફ્ટ) મુરમ માટે રોયલ્ટી લેવાની થશે નહીં તથા સંદર્ભ (૪) હેઠળના વિભાગના તા. ૬-૧૧-૮૭ના ઠરાવથી ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવતાં કામો માટે પણ ઉપર મુજબ રોયલ્ટી મુકિતનો લાભ આપવામાં આવેલ.

ઉપર્યુક્ત જોગવાઈઓના કારણે રાજ્યમાં ગેરકાયદેસર રીતે આ ખનિજોનો વપરાશ થતો હોવાનું જણાવેલ છે. જેના પરિણામે રાજ્ય સરકારે રોયલ્ટીની આવક ગુમાવવી પડે છે માટે ઉપરોક્ત હુકમોની જોગવાઈની સમીક્ષા કરી તે દુર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તા. ૧૮-૬-૨૦૦૪ના રોજ માન. મુખ્ય મંત્રીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ એમ્પાવર્ડ કમીટીની બેઠકમાં નક્કી થયા મુજબ સંદર્ભ-૩ તથા સંદર્ભ-૪ હેઠળના વિભાગના તા. ૨૫-૧-૮૧ તથા તા. ૬-૧૧-૮૭ના ઠરાવો આથી રદ કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

સહી/-
(આર.બી.વ્યાસ)
નાયબ સચિવ
ઉદ્યોગ અને ખાણ વિભાગ

પ્રતિ,

- મા. મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી, મા. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
- રાજ્ય કક્ષાના મંત્રીશ્રી (ઉદ્યોગ અને ખાણ) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- અગ્રસચિવશ્રી, નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- અગ્રસચિવશ્રી, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- અગ્રસચિવશ્રી, મહેસુલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- અગ્રસચિવશ્રી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સચિવશ્રી, નર્મદા અને જળ સંપત્તિ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- મેનેજીંગ ડીરેક્ટરશ્રી, સરદાર સરોવર નર્મદા વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સભ્યસચિવશ્રી, ગુજરાત વિદ્યુત બોર્ડ, રેસકોર્સ, વડોદરા.
- સચિવાલયના સર્વ વિભાગો.
- એકાઉન્ટ જનરલશ્રી, અમદાવાદ/ રાજકોટ.
- વિકાસ કમિશ્નરશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
- સર્વ મુખ્ય ઈજનેરશ્રીઓ.
- કમિશ્નરશ્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, ગાંધીનગર.
- મુખ્ય વન સંરક્ષકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
- ડાયરેક્ટર એકાઉન્ટન્ટ એન્ડ ટ્રેઝરી, ગાંધીનગર.
- રાજ્યના સર્વ ખાતાના વડાઓ.
- સર્વ કલેક્ટરશ્રીઓ.
- સર્વ મામલતદારશ્રીઓ/ મહાલેખાકારશ્રીઓ.
- સર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ.
- સર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ.
- સર્વ અધિક્ષક ઈજનેરશ્રીઓ, જળ સંપત્તિ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા વિભાગ.
- સર્વ કાર્યપાલક ઈજનેરશ્રીઓ જળ સંપત્તિ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા વિભાગ.
- સર્વ વન સંરક્ષકશ્રીઓ.
- સર્વ જિલ્લા ભુસ્તરશાસ્ત્રીશ્રી, કલેક્ટર કચેરી (ખનિજ શાખા)
- પે એન્ડ એકાઉન્ટસ ઓફીસર ગાંધીનગર/ સિલેક્ટ ફાઈલ.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ,
પરિપત્ર ક્રમાંક: ટીએનસી-૧૦-૨૦૨-(૧૪)-સ,
સચિવાલય, ગાંધીનગર
તારીખ: ૨૭-૪-૨૦૦૫.

વિષય : રાજ્ય સરકારના બાંધકામ માટે વપરાતા ગૌણ ખનિજની રોયલ્ટી ભરવા બાબત.

સંદર્ભ : ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક: એમએમઆર-૧૧૨૦૦૦-૨૦૧૩-છ તા. ૧-૩-૨૦૦૪.

પ રિ પ ત્ર :

ઉદ્યોગ, ખાણ અને ઊર્જા વિભાગના તા.૨૫-૧-૯૧ના ઠરાવ ક્રમાંક: એમસીઆર- ૨૧૮૮-(૮)-છ અન્વયે રાજ્ય સરકારના પંચાયતોના અને સરદાર સરોવર નર્મદા નિગમના બાંધવામાં આવતાં રસ્તાઓના કે સિંચાઈ વિગેરેના કામો માટે જ્યારે સાદરી માટી (ઓર્ડીનરી ક્લે-અર્થ) અને (સોફ્ટ) મુરમ નાંખવામાં આવે ત્યારે ગુજરાત ગૌણ ખનિજ નિયમ-૧૯૬૬ મુજબ રોયલ્ટી લેવાના નિયમો લાગુ પડશે નહિ એટલે કે આ કામો માટે કોન્ટ્રાક્ટરો પાસે માટી (ઓર્ડીનરી ક્લે-અર્થ) અને (સોફ્ટ) મુરમ માટે રોયલ્ટી લેવાની થશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. હવે ઉપર સંદર્ભમાં દર્શાવેલ ઉદ્યોગ અને ખાણ વિભાગના તા. ૧-૯-૨૦૦૪ના ઠરાવથી તા.૨૫-૧-૯૧નો ઠરાવ રદ કરવામાં આવેલ છે.

આથી હવે બી.૧ ટેન્ડરના ફોર્મમાં ખંડ-૩૬ અને બી.૨ ટેન્ડર ફોર્મમાં ખંડ-૩૫માં નીચે મુજબ સુધારા કરવામાં આવે છે.

રાજ્ય સરકારના બાંધકામ માટે વપરાતા ગૌણ ખનિજની રોયલ્ટી બાબત.

- (૧) તા. ૧-૯-૯૧ના ઠરાવ મુજબ મુરમ સિવાયના કામ સુધીના શબ્દો રદ કરી ફક્ત નીચે મુજબ જોગવાઈ અમલમાં રહેશે.
- (૨) ગૌણ ખનિજ બાબતમાં ગુ.ગૌ.અ.નિ. ૧૯૬૬ અને તેના અનુસંધાનમાં વખતોવખત બહાર પાડવામાં આવેલ ઠરાવો લાગુ પડશે અને તે મુજબ લીઝ કે પરમીટ લેવાનું અને રોયલ્ટી ભરવાની રહેશે. (ઉદ્યોગ અને ખાણ વિભાગ ઠરાવ ક્રમાંક: એમએમઆર-૧૧-૨૦૦૦-૨૦૧૩-છ, તા. ૧-૯-૦૪)

સહી/-
(અશોક પંડ્યા)
ઉપસચિવ
માર્ગ અને મકાન વિભાગ

પ્રતિ,

સર્વે અધિક્ષક ઈજનેરશ્રીઓ,

(મા.મ.વર્તુળો/ પંચાયત (મા.મ) વર્તુળો/એક્સપ્રેસ વે વર્તુળ/ રાજ્ય માર્ગ યોજના વર્તુળ/

રાષ્ટ્રીય ધોરી માર્ગ વર્તુળો/ પાટનગર યોજના વર્તુળ સહિત)

સર્વે કાર્યપાલક ઈજનેરશ્રીઓ (ઉપરોક્ત વર્તુળો હેઠળના તમામ વિભાગો સહિત)

નકલ રવાના :

- ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- નિયામકશ્રી, એન્જીનીયરીંગ સ્ટાફ કોલેજ, ગાંધીનગર.
- મેનેજીંગ ડાયરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય બાંધકામ નિગમ લી. ગાંધીનગર.
- માર્ગ વિકાસ નિગમ લી. ગાંધીનગર.
- મા.મ.વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સીલેક્ટર ફાઇલ.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ,
પરિપત્ર ક્રમાંક: એસ.એસ.આર-૧૦૨૦૦૪-આઈબી-૪૧(૨૪) સ,
સચિવાલય, ગાંધીનગર
તારીખ: ૨-૧૨-૨૦૦૬

વિષય: મકાનો અને અન્ય બાંધકામના કામદારોના કલ્યાણ સેસ એક્ટ ૧૯૮૬ હેઠળ ૧% સેસ "ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ વેલફેર બોર્ડ"માં જમા કરાવવા અંગે.

સંદર્ભ: (૧) શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો ઠરાવ ક્રમાંક: સીડબલ્યુએ-૨૦૦૬-૮૪૧-એમ-૩ તા. ૩૦-૧-૨૦૦૬
(૨) શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો ઠરાવ ક્રમાંક: સીડબલ્યુએ-૨૦૦૬-૧૮૩૧-એમ-૩, તા. ૮-૧૨-૨૦૦૫

પ રિ પ ત્ર :

ઉપરોક્ત વિષયના સંદર્ભમાં દર્શાવેલ શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા. ૩૦-૧-૨૦૦૬ તથા તા. ૮-૧૨-૨૦૦૫ના ઠરાવો (નકલ સામેલ છે.) તરફ સર્વે સંબંધિતોનું ધ્યાન દોરતાં આથી જણાવવામાં આવે છે કે મંજૂર કરાતા ડ્રાફ્ટ ડેન્ડર્સ પેપર્સમાં "સેસ" અંગે જોગવાઈ કરીને ઈજારદારોના દર મહિને કરેલ કામના બિલોના ચુકવણામાંથી ૧ (એક) ટકો સેસ કાપીને તે રકમ ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ વેલફેર બોર્ડ" ના સંદર્ભ (૨) હેઠળના ઠરાવથી નિયત કરેલ હેડ-સબ હેડ ખાતે સંબંધિત કાર્યપાલક ઈજનેરશ્રી ધ્વારા જમા કરાવવાની રહેશે. હવે પછીના જે નવા અંદાજો મંજૂર કરવામાં આવે તેવા અંદાજની દરેક આઈટમના ભાવોમાં ૧% વધારો કરીને વધારેલ ભાવ મુજબ અંદાજો મંજૂર કરવાના રહેશે તથા ડ્રાફ્ટ ડેન્ડર્સ પેપર્સમાં તે મુજબ રકમ મુકવાની રહેશે.

આ સુચનાઓનો અમલ ચુસ્ત પછે થાય તેની દરેક દરેક સંબંધિતોને નોંધ લઈ તે મુજબ કાર્યવાહી અચૂક રીતે હાથ ધરવાની રહેશે.

સહી/-
(અશોક પંડ્યા)
ઉપસચિવ
માર્ગ અને મકાન વિભાગ.

નકલ રવાના :

- સર્વે અધિક્ષક ઈજનેરશ્રીઓ, મા.મ.વર્તુળ/ પંચાયત મા.મ.વર્તુળ, ને.હા.વર્તુળ, એક્સપ્રેસવ
- વર્તુળ, રા.ધો.મા.યો. વર્તુળ તથા ઈલેક્ટ્રીક મા.મ.વર્તુળ, સહિત
- સર્વે કાર્યપાલક ઈજનેરશ્રીઓ, ઉપરોક્ત વર્તુળો હસ્કના સર્વે વિભાગો
- વિભાગના દરેક તાંત્રિક અધિકારીઓ, ના.કા.ઈ.શ્રીઓ સહિત મા.મ.વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

મશીન ક્રશ્ન સ્ટોન એગ્રીગેટના ફલેકીનેશ અને ઈલોન્ગેશન
ઈન્ડેક્સના સંયુક્ત ધોરણો અપનાવવા બાબત.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ
પરિત્ર ક્રમાંક : એસ.ઓ.આર - ૧૦૨૦૦૬/૧૦૪/સ.૧
સચિવાલય, ગાંધીનગર
તા.૨૫/૧/૨૦૦૭

પ્રસ્તાવના :-

'મશીન ક્રશ્ન સ્ટોન એગ્રીગેટ એ બાંધકામમાં વપરાતું મુખ્ય મટીરીયલ્સ છે. આ 'મટીરીયલ્સ' માટેના ગુણવત્તાના વિવિધ ધોરણો પૈકીનો એક 'ફલેકીનેશ અને ઈલોન્ગેશન ઈન્ડેક્સ (સંયુક્ત)' છે જે મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (ફીચર્ ૬ જ) ધ્વારા પ્રકાશિત સ્પેશીફિકેશન ફોર રોડ એન્ડ બ્રીજ વર્કની ચોથી આવૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ૩૦% થી વધુ ન હોવો જોઈએ. જ્યારે અગાઉ મીનીસ્ટ્રી ઓફ સરકેઈસ ટ્રાન્સપોર્ટની બીજી આવૃત્તિમાં ફક્ત ફલેકીનેશ ઈન્ડેક્સનું ધોરણ વધુમાં વધુ ૩૫% સુધીનું હતું. આમ સંશોધનો / અનુભવ તેમજ અદ્યતન મશીનરીની ઉપલબ્ધીનો વ્યાપ/ સરળતા તેમજ આર્થિક પાસાઓને ધ્યાને લઈને ગુણવત્તાના ધોરણોમાં પણ નવા સુધારા / વધારા કરવામાં આવે છે. અગાઉના ફલેકીનેશ ઈન્ડેક્સના ધોરણોમાં હવે ઈલોન્ગેશન ઈન્ડેક્સ પણ જોડી સંયુક્ત ધોરણ દાખલ કરવામાં આવેલ છે. પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ ક્રશર યુનિટો પૈકીના મોટા ભાગના યુનિટો પરંપરાગત પદ્ધતિથી કાર્યરત છે. તેમાંથી નવા સંયુક્ત ધોરણો પરિપૂર્ણ કરે તેવો ઉત્પાદિન માલ મળી શકતો નથી. જે એક વ્યવહારીક મુશ્કેલી છે. પરંપરાગત પદ્ધતિના ક્રશરમાં આ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે બાબતનો ઉલ્લેખ ટેકનીકલ જર્નલમાં પ્રસિધ્ધ થતા ટેકનીકલ પેપર્સમાં પણ થયેલ છે. આથી સંયુક્ત ધોરણો મેળવવા હાલના ક્રશર યુનિટોમાં સારા એવા પ્રમાણમાં સુધારા વધારા કરવા આવશ્યક બને તેમ છે. જેમાં વધારાનું નાણાંકીય રોકાણ પણ કરવું પડે તેમજ સમય પણ વ્યતિત થાય આથી ફલેકીનેશ તેમજ ઈલોન્ગેશન ઈન્ડેક્સના સંયુક્ત ધોરણોનો અમલ કરવા (ઈજારદારોને) પૂરતો સમય આપવો પણ જરૂરી છે. તે ધ્યાને લઈ નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.

મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ધ્વારા સ્પેશીફિકેશન ફોર રોડ એન્ડ બ્રીજ વર્કની સને ૨૦૦૧ ની ચોથી આવૃત્તિ અનુસાર મશીન ક્રશ્ન સ્ટોન એગ્રીગેટ માટે ફલેકીનેશ તેમજ ઈલોન્ગેશન સંયુક્ત ઈન્ડેક્સની મહત્તમ ૩૦ % ની મર્યાદાનું ધોરણ અપનાવવાનું નક્કી કરવામાં આવેલ છે.

માર્ગ અને મકાન વિભાગ હસ્તક ચાલતા કામોમાં પ્રવર્તમાન સ્પેશીફિકેશન પ્રમાણે ફલેકીનેશ અને ઈલોન્ગેશનના સંયુક્ત ઈન્ડેક્સની મહત્તમ મર્યાદા ૩૦ % રાખવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં મોટા ભાગના ક્રશીંગ યુનિટો ખાનગી માલિકીના છે અને તેમાં જરૂરી યાંત્રિક ફેરફારો કરવામાં આવે તો સંયુક્ત ઈન્ડેક્સના ધારા ધોરણો જળવાઈ રહે તેવો માલ મળી શકે.

ગુજરાત રાજ્યમાં ચાલતા ખાનગી મશીન મશીનોમાં જરૂરી યાંત્રિક સુધારા વધારા તા.૩૦/૯/૦૭ સુધીમાં કરવામાં આવે તો જ તા.૧/૧૦/૦૭ પછીથી માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓમાં વપરાતા એગ્રીગેટની ગુણવત્તા ધારા ધોરણ મુજબની મળી રહે. આથી નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.

- (અ) માર્ગ અને મકાન વિભાગમાં ચાલતા કામોના ઈજારદારોએ જે તે ક્રશીંગ યુનિટોમાં જરૂરી યાંત્રિક સુધારા વધારા થઈ ગયેલ છે અને ધારા ધોરણ મુજબની ગુણવત્તાના એગ્રીગેટ મળી રહે છે તેવું પ્રમાણપત્ર અધિક્ષક ઈજનેરશ્રી (યાંત્રિક) અમદાવાદ મા.મ.વર્તુળ, અમદાવાદનું હોંય તેની પાસેથી જ માલ સામાન ખરીદ કરવાનો રહેશે. આ પ્રમાણિત થયેલ ક્રશીંગ યુનિટ સિવાયના કોઈપણ પ્રકાર પાસેથી માલ સામાન સપ્લાય ન થાય તેની કાળજી લેવાની રહેશે. અધિક્ષક ઈજનેરશ્રી (યાંત્રિક) ધ્વારા સર્ટીફાઈડ ન થયેલ ક્રશીંગ યુનિટ પાસેથી આવેલ ધારા ધોરણ વગરનો માલ સામાન આઉટરાઈટ રીજેક્ટ કરવામાં આવશે.
- (બ) માર્ગ અને મકાન વિભાગના એસ. ઓ. આર. માં તથા અંદાજોમાં એગ્રીગેટના ભાવમાં જરૂરી સુધારો વધારા કરીને તા.૧/૧૦/૦૭ થી અમલમાં લાવવાના રહેશે.
- (ક) દરેક વિભાગીય કચેરીઓએ તેઓના તાબામાં જે જે ઈજારદારોની નોંધણી થયેલ છે તેઓને સદરહું સૂચનાઓ અમલ કરવા માટે લેખિત કરવાની રહેશે તથા ખાનગી ક્રશીંગ યુનિટોને પણ આવી લેખિત જાણ કરવાની રહેશે. સદરહું સૂચનાના અમલ માટે ખાનગી ક્રશર યુનિટો તેમજ ઈજારદારો સાથે દરેક વિભાગીય કચેરીએ એક સંયુક્ત બંદક કરીને સમજ આપવાની રહેશે. જેથી તા.૧/૧૦/૦૭ પછી માર્ગ અને મકાન વિભાગ હસ્તક ચાલતા કોઈપણ કામોમાં ધારા ધોરણ મુજબની ગુણવત્તા સિવાયનો માલ સામાન વાપરવામાં ન આવે તેની તકેદારી રાખવાની રહેશે. ઉપરોક્ત સૂચનાઓની અમલ ચુસ્તપણે કરવાનો રહેશે.

(એસ. એ. ભટ્ટ)
ઉપસચિવ મુ.મ.
માર્ગ અને મકાન વિભાગ,